



# અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ

## વિકાસ પરવાનગીની અરજીની પ્રાથમિક વિગતો

અરજદારનું નામ : .....

સરનામું : .....

.....

ગામનું નામ મોજે : .....

ટી.પી.સ્કીમ નં. : .....

રેવન્યુ સર્વે નંબર : ..... ક્ષેત્રફળ : ..... ચો.મી.

મુળ ખંડ નંબર : ..... ક્ષેત્રફળ : ..... ચો.મી.

અંતિમખંડ નંબર : ..... ક્ષેત્રફળ : ..... ચો.મી. કપાત : .....%

સબપ્લોટ નંબર : ..... ક્ષેત્રફળ : ..... ચો.મી.

(૧) રજી. આર્કી/એન્જિનિયરિંગ નામ : રજી.નં.\_\_\_\_\_ તા.\_\_\_\_\_

સરનામું :

(૨) રજી.સ્ટ્રક્ચરલ એન્જિનિયર નામ : રજી.નં.\_\_\_\_\_ તા.\_\_\_\_\_

સરનામું :

(૩) રજી.કલાર્ક ઓફ વર્ક્સ નું નામ : રજી.નં.\_\_\_\_\_ તા.\_\_\_\_\_

સરનામું :

(૪) ડેવલપરશ્રી નું નામ : રજી.નં.\_\_\_\_\_ તા.\_\_\_\_\_

સરનામું :

(I) પ્રાથમીક ચકાસણી :**અરજુ ફોર્મની ચકાસણી :-**

(૧)

૧. નિયત ફોર્મમાં અરજુ કર્યા તારીખ : .....
૨. અરજુમાં સંપૂર્ણ વિગતો ભરેલ છે કે કેમ? : .....
૩. અરજુ ફોર્મમાં ૭/૧૨ પ્રમાણે તમામ અધિકૃત જમીન માલિકની સહિતો છે કે કેમ? : .....
૪. અરજુ ફોર્મમાં રજી.ડેવલપરની સહી છે કે કેમ? : .....
૫. અરજુ ફોર્મ સાથે રજુ કરવાના થતાં દસ્તાવેજ પુરાવા અસલ / મુળ નકલ
- ૭/૧૨ નો ઉતારો
  - ગામ નમુનો-૬, હક્કપત્રક
  - ટીપ્પણી
  - હિસ્સા પડેલ હોય તો હિસ્સા ફોર્મ નં.૧૧-અ
  - વિકાસ નકશાનો પાર્ટ પ્લાન
  - ઝોનોંગ સર્ટિફીકેટ
  - ટી.પી. સ્કીમ પાર્ટ પ્લાન
  - ફોર્મ-ઓફ ની નકલ
  - માપણીશીટ
  - બોન્ડ ૨(a), (b), (c), ૨(d)
  - ટી.પી. / ટી.પી. કપાતનું બાહેદરી પત્ર
  - સ્કીમ ફાઇનલ હોય તો, કબજા પાવતી
  - સોછલ ટેસ્ટિંગનો રીપોર્ટ
  - ડ્રેનેજ અંગેનું સોછલ સર્ટી.
  - લાગુ પડતુ હોય ત્યાં સંબંધિત ખાતાનું ના-વાંધા પ્રમાણપત્ર / નકશા
  - રજીસ્ટર્ડ આર્કિટે ટ / એન્જિનીયર / સ્ટ્રક્ચરલ એન્જિનીયર / કલાર્ક ઓફ વર્ક્સ / ડેવલોપર્સ ના સેલ્ફ એટેસ્ટેડ પ્રમાણપત્ર.
  - ટી.પી. સ્કીમનાં ફાઇનલ પ્લોટમાં અન્યનાં મુળખંડમાંથી સર્વે નંબરની ભળતી જમીન જમીનનાં ૭/૧૨ ના ઉતારા
  - ટી.પી. સ્કીમનાં ફાઇનલ પ્લોટમાં અન્યનાં સર્વે નંબર / મુળખંડમાંથી ભળતી જમીન અંગે સંબંધિત જમીન માલિકોના સંમતી પત્રો.

મહેસુલી દસ્તાવેજોની ચકાસણી:-

૧. રજુ કરેલ અન્યની તારીખથી ત્રણ માસની સમય મર્યાદા સુધીના રજુ કરેલ છે?

રજુ કરવાનાં થતાં ૭/૧૨ / પોપટી કાર્ડ ના ઉતારા	રજુ કરેલ અન્યની તારીખથી ત્રણ માસની સમય મર્યાદા સુધીના રજુ કરેલ છે?	જરૂરી તમામ અન્યની તારીખથી ત્રણ માસની સમય મર્યાદા સુધીના રજુ કરેલ છે કે કેમ?	વિશેષ નોંધ (નવી શરત / જુની શરત / બીજા હક્ક તથા અન્ય, શરતો / નિયત્રણો વિગેરે)
૧	૨	૩	૪

સર્વે નંબર / બ્લોક નંબર / અંતિમખંડ નંબર	જમીન માલિકના અન્યની તારીખથી ત્રણ મુજબ પુરા નામ
૧	૨

અંતિમખંડમાં ભળતી અન્યની જમીનનો સર્વે નંબર.	અન્યની જમીનના તારીખથી ત્રણ મુજબ જમીન માલિકને નામ	જમીન માલિકનોની સહીઓની ચકાસણી અંગો નો અહેવાલ	રજુ કરેલ કબજા કરાર ની ચકાસણીનો નો અહેવાલ	નોંધ

(૨) નીચે મુજબનાં ઉતારા પૈકી લાગુ પડતાં ઉતારા અરજીની તારીખથી ત્રણ માસ પહેલાની તારીખ સુધીનાં રજુ કરેલ છે.

અંતિમખંડમાં ભળતા સર્વે નંબર	અંતિમખંડમાં ભળતી અન્યની જમીનનો સર્વે નંબર	જરૂરી તારીખ	રજુ કરેલ તારીખ	વિશેષ નોંધ

## (૩) ગામ નમુના દ્વારા ચકાસણી

સર્વે નંબર / બ્લોક નંબર / અંતિમખંડ નંબર	ગામ નમુના દ્વારા ની જરૂરી એન્ટ્રીઓ	ગામ નમુના દ્વારા રજુ કરેલ એન્ટ્રીઓ	નિયમ અનુસાર ગામ નમુના દ્વારા તમામ એન્ટ્રીની ચકાસણીનો અભિપ્રાય	વિશેષ નાંદ્ધ
૧	૨	૩	૪	૫

## (૪-અ) કુલમુખ્તયારનામાની ચકાસણી

સર્વે નંબર / બ્લોક નંબર / અંતિમખંડ નંબર	૭/૧૨ મુજબ જમીન માલિકના નામો	કુલમુખ્તયારનું નામ	નિયમ અનુસાર કુલમુખ્તયારનામાની ચકાસણીનો અભિપ્રાય
૧	૨	૩	૪

## (૪-બ) બિનખેતીની ચકાસણી

બિનખેતી થયેલ સર્વે નંબર / બ્લોક નંબર / અંતિમખંડ નંબર	બિનખેતી થયેલ સર્વે નંબર / બ્લોક નંબર / અંતિમખંડ નંબરનું ક્ષેત્રફળ	બિનખેતીનો હેતુ	સુચીત ઉપયોગ અને ક્ષેત્રફળ	બિનખેતીના હુકમ સાથે સુસંગત છે કે કેમ?
૧	૨	૩	૪	૫

(૪) હિસ્સા અથવા સબ પ્લોટ અંગેની ચકાસણી.....

(અ) હિસ્સા માપણીની ટીપ્પણ મુળ નકલ અથવા મંજુર થયેલ સબ પ્લોટીંગના નકશાની પ્રમાણીત નકલ રજુ કરેલ છે કે કેમ?

(ભ) હિસ્સાના કિસ્સામાં ફોર્મ-૧૧-અ ના ઉતારાની અસલ નકલ રજુ કરેલ છે કે કેમ?

(૬) (અ) અગાઉની પરવાનગીના હુકમ તથા લેઆઉટ પ્લાન અને બીટીંગ પ્લાનની લાયસન્સ આર્કિટેક્ટ / એન્જિનીયર દ્વારા પ્રમાણિત કરેલ નકલ રજુ કરેલ છે ?

(૭) વિકાસ નકશાનો વિભાગીય નકશો રજુ કરેલ છે ? .....

(૮) ઝોનીંગ પ્રમાણપત્ર રજુ કરેલ છે ? .....

(૯) ઝોનની વિગત :- (૨હેણાંક-૧/૨હેણાંક-૨/૨હેણાંક-૩/ વાણિજ્ય/ ઔધોગિક/ ખેતીવાડી / અનામત વિસ્તાર)  
.....

### ટી.પી. સ્કીમ:

(૧૦) ટી.પી.સ્કીમમાં આવતી જમીન માટે

(અ) ડ્રાઇટ / પ્રીલી. / ફાઇનલ ટી.પી. સ્કીમ નં.....

(ભ) ટી.પી. સ્કીમનો તથકો ..... (૧) મુસદારૂપ નગર

રચના યોજના બનાવવાની બાકી ..... (૨) મુસદારૂપ નગર રચના યોજના

બનાવવાની કામગીરી જરીમાં .....

(અ) ઓનર્સ મીટીંગ બાકી

(ભ) ઓનર્સ મીટીંગ થયેલ છે.

(ક) સરકારશ્રીમાં મંજુરી માટે મોકલવાની બાકી

(૩) મુસદારૂપ નગર રચના યોજના સરકારશ્રીમાં મંજુરી સારુ સાદર ..... (૪) મુસદારૂપ

નગર રચના યોજના સરકારશ્રીએ મંજુર કરેલ છે. ..... (૬) મુ.ન.૨. યો. નગર રચના

અધિકારીશ્રી પાસે રીકોન્સ્ટીટ્યુશન હેઠળ ..... (૭) નગર રચના અધિકારીશ્રી ધ્વારા પ્રિલીમનરી

સ્કીમ એવોર્ડ જાહેર કરેલ છે. ..... (૮) નગર રચના અધિકારીશ્રી ધ્વારા પ્રિલમનરી સ્કીમ સરકારશ્રીમાં

મંજુરી સારુ સાદર કરેલ છે. .....

(૯) પ્રિલીમનરી સ્કીમ / ફાઇનલ સ્કીમ સરકારશ્રી ધ્વારા મંજુર .....

(ક)

ડ્રાઇટ સ્કીમની દરખાસ્ત	નગર રચના અધિકારીશ્રીની દરખાસ્ત
સર્વે / બ્લોક નં.....	સર્વે / બ્લોક નં.....
મુજાહંડ નં....., ક્ષેત્રફળ .....	મુજાહંડ નં....., ક્ષેત્રફળ .....
અંતિમખંડ નં....., ક્ષેત્રફળ .....	અંતિમખંડ નં....., ક્ષેત્રફળ .....
કપાત .....%	કપાત .....%
મુજાહંડ અને અંતિમખંડની સ્થળ સ્થીતીની પરીસ્થીતી સાથેની વિગત (ફેરફારની વિગત):	મુજાહંડ અને અંતિમખંડની સ્થળ સ્થીતીની પરીસ્થીતી સાથેની વિગત (ફેરફારની વિગત):

- (૩) ટી.પી.સ્કીમના પાર્ટખાનની મુજાહનકલ રજુ કરેલ છે ? .....
- (૪) માપણી શીટની નકલ રજુ કરેલ છે ?.....
- (૫) ફોર્મ-એફ રજુ કરેલ છે ? .....
- (૬) ટી.પી.સ્કીમ વિસ્તારમાં ન હોય તેવી જમીનો માટે
- (અ) ટીપ્પણની નકલ/ પ્લોટબુક / હિસ્સામાપણી ની નકલ રજુ કરેલ છે ? અને હિસ્સા ફોર્મ નં.૪ રજુ કરેલ છે? .
- (બ) વિકાસ યોજનાની દરખાસ્તની અસર થાય છે ? .....
- (૭) જાહેર રસ્તાની પહોળાઈ ..... છે ? કેટેગરી- (N.H / S.H / M.D.R/ O.D.R / Nalia Road) લખવી
- (અ) નાળીયા રોડની મધ્ય રેખાથી જ.ડી.સી.આર. રેન્યુ.નં.૧૦.૪ મુજબ ૬.૦ મી. અંતર છોડી ખ્લોટની નવી હદરેખા દર્શાવેલ છે.
- (૯૧) સુચીત ઉપયોગ મળવાપાત્ર છે. ....
- ડી.પી. ઝોન્સિંગ મુજબ .....
- (૧૨) રજીસ્ટરડ અન્જનીયરનું ડ્રેનેજ અંગેનું વોટર એબ્સોર્પશન અંગેનું સોધલ સર્ટીફિકેટ રજુ કરેલ છે ? અથવા ડ્રેનેજ કને શન મળવા બાબતનો આધાર રજુ રાખેલો છે ?
- (૧૪) ટી.પી.સ્કીમની દરખાસ્ત મુજબ મુજાહંડમાંથી સોપવાનાં થતાં કબજાની વિગતો
- (૧) અનામત જમીન માટે અંતિમખંડ નં. ...., ...., ક્ષેત્રફળ ....., ....., ચો.મી.

<p>(૨) રસ્તા માટે ..... મી. પહોળો જેનું ક્ષેત્રફળ ..... ,ચો.મી.</p> <p>(૩) અન્ય અંતિમખંડ માટે અંતિમખંડ ..... , ક્ષેત્રફળ ..... ચો.મી.</p> <p>(૧૫) પ્રક્રનવાળી જમીન બાબતે કોર્ટમેટર ચાલુ હોય તો? તે દાવા નં. ...., અને અંતિમ સ્થિતી ..... કોર્ટ મેટર અંગે ટૂંકમાં હકીકત અને સાથે સદર પ્રકરણે પરવાનગી આપવા / ન આપવા અંગે ખાનીંગ આસી. નો સ્પષ્ટ અહેવાલ.....</p> <p>(૧૬) (૧) શ.જ.ટોચ મર્યાદા અને નિયમન અધિનિયમ-૧૯૭૬ હેઠળ અતે પછાયેલ ઉપલબ્ધ ફાજલ તથા તકરારી કોર્ટમેટર અંગેના લીસ્ટમાં સમાવેશ થતી જમીન છે કે કેમ ?</p> <p>(૨) ફાજલ જાહેર થયેલ છે. પરંતુ તેનો કબજો સરકારશ્રીએ સંભાળેલ નથી તેવું નિયત પરફોર્મ મુજબનું બોન્ડ/ બાંહેધરી રજુ કરેલ છે ? .....</p> <p>(૧૭) અંડર ટેઇકીંગ બોન્ડ બધીજ વિગતો ભરીને તેમજ જરૂરી સહીસિક્કા કરીને રજુ કરેલ છે ? .....</p> <p>૨ (a) પૂ. _____ ૨ (b) પૂ. _____      ૨ (c) પૂ. _____ ૨ (d) પૂ. _____      ૨ (d) એનેક્સર પૂ. _____</p> <p>(૧૮) ફેમ સ્ટ્રક્ચર પ્રકારનાં બાંધકામ માટે સોછલ બેરોંગ કેપીસીટી સંદર્ભ સોછલ ઇન્વેસ્ટિગેશન રીપોર્ટ રજુ કરેલ છે ? .....</p> <p>(૧૯) લે-આઉટ તથા તમામ ટાઇપના બિલ્ડિંગ ખાનમાં જરૂરી વિગતો દર્શાવીને, જરૂરી સહી સીક્કા કરીને પાંચ નકલમાં રજુ કરેલ છે ? .....</p> <p>(૨૦) પ્રક્રનવાળી જમીન પ્રતિબંધીત સત્તાપ્રકારની / નવી અને અવિભાજ્ય સત્તાપ્રકારની છે. જો હોય તો બીનખેતીના હેતુ માટે ઉપયોગ કરવાની પરવાનગી મેળવેલ છે કે કેમ ?</p> <p>(૨૧) ખાનમાં દર્શાવવાની વિગતો</p> <p>(એ) ક્રી-ખાનમાં આસપાસનાં સર્વ નં. / અંતિમખંડો દર્શાવેલ છે?</p> <p>(બી) ક્રી-ખાન બ્લોક નં. / નવા સર્વ નંબર પ્રમાણે હોય તે કિસ્સામાં મુળ સર્વ નંબરની વિગત આપેલ છે?</p> <p>(સી) ક્રી ખાનમાં સવાલવાળી જમીનને અધિકૃત રસ્તાથી / મેળવેલ રસ્તાથી લીધેલ પ્રવેશ દર્શાવેલ છે.</p> <p>(ડી) પ્રક્રનવાળી જમીનમાંથી ઇલેક્ટ્રીક ગ્રીડ લાઇન / O.N.G.C. પાઇપ લાઇન પસાર થાય છે કે કેમ ?</p> <p>પસાર થતી હોય તો સદર લાઇન ..... કે.વી ની છે. અને બિલ્ડિંગ કંટ્રોલ લાઇન ..... મી. દર્શાવેલ છે.</p>	
---	--

<p>(૯) પ્રક્ષનવાળી જમીન રેલ્વે હદથી અડીને છે ? જો હા તો હદથી રેલ્વે ઓથોરીટીનું N.O.C રજુ કરેલ છે ? / રેલ્વે હદથી ૩૦.૦ મી અંતર દર્શાવેલ છે ?</p> <p>(એફ) પ્રક્ષનવાળી જમીન નદી, નાળા, તળાવ, કાંસ, વહેણો, ને અડીને હોય તો તેવા કેસમાં નામદાર હાઇકોર્ટના દી.મુ.નં. ૧૧૦૪૬/૨૦૦૧ ના હુકમ અન્વયે હદથી ૮.૦ મી. માર્જન દર્શાવેલ છે કે કેમ ?</p> <p>(ગ) પ્રક્ષનવાળી જમીનમાં O.N.G.C ની પાઇપલાઇન / કુવો આવેલા છે કે કેમ ? જો હા, તો O.N.G.C ની પાઇપલાઇન / કુવો તથા નિયંત્રણ અંતરની વિગતો દર્શાવેલ છે કે કેમ ?</p>	
---	--

## II લે આઉટના નકશાની ચકાસણી

### પાર્ટ - એ

<p>(૧) નકશામાં ટાઇટલ નીયમ મુજબ દર્શાવેલ છે. ....</p> <p>(૨) જમીનની હદ તથા માપ-ટિપ્પણી / ટી.પી.સ્કીમની / મંજૂર થયેલા નકશા મુજબ સુસંગત છે ? .....</p> <p>(૩) નકશામાં દર્શાવેલ ક્ષેત્રફળ _____ ચો.મી છે. જે ૭/૧૨ નો ઉતારો / એફ ફોર્મ / મંજૂર થયેલ નકશો / હિસ્સા ફોર્મ-૪ / પ્રોપર્ટી કાર્ડ સાથે સુસંગત છે ? .....</p> <p>(૪) કી પ્લાનમાં આસપાસનાં સર્વે નંબર / અંતિમખંડ નંબર / અધિકૃત રસ્તાથી / મેળવેલ રસ્તાથી પ્રવેશ દર્શાવેલ છે?</p> <p>(૫) નોર્થ અને ડકેલ દર્શાવેલ છે જે ટી.પી.સ્કીમ/ ટી.પી. સાથે સુસંગત છે ?</p> <p>(૬) પ્રક્ષનવાળી જમીનનાં પ્રવેશ અંગે</p> <ul style="list-style-type: none"> <li>(૧) હયાત રસ્તાની પહોળાઈ ..... મી.</li> <li>(૨) સૂચિત રસ્તાની પહોળાઈ ..... મી.</li> <li>(૩) વૈકલ્પિક એપ્રોયની વ્યવસ્થા ..... મી.</li> </ul> <p>(૭) અન્ય માલિકોની જમીનમાંથી મેળવવાના થતા પ્રવેશ / રસ્તા બાબતે જે તે જમીનના ૭/૧૨ ના ઉતારા તથા નિયત પહોળાઈનાં રસ્તા અંગેના કરાર રજુ કરેલ છે ? ...</p> <p>(૮) ટી.પી. સ્કીમ વિસ્તાર સિવાયનાં વિસ્તાર માટે હયાત રસ્તાથી પ્રક્ષન હેઠળની જમીન સુધીની રોડની લંબાઈ ધ્યાને લેતા પહોળાઈ જ.ડી.સી.આર.ની જોગવાઈ મુજબ</p>	
---	--

દર્શાવેલી છે? .....						
<b>પાર્ટ - બી</b>						
(૧) મથાળું દરખાસ્ત પ્રમાણે યોગ્યરીતે દર્શાવેલું છે? .....						
(૨) ઝોન, યુઝ અને સ્કેલ દર્શાવેલ છે ? .....						
(૩) બિલ્ડિંગ યુનિટનાં ક્ષેત્રફળમાંથી તમામ પ્રકારની કપાત દર્શાવી નેટ પ્લોટ એરોયા દર્શાવેલ છે ?						
(૪) (અ) સુચિત વપરાશ ઝોન અનુસાર મળવાપાત્ર છે ? (બ) સુચિત વપરાશ બીલ્ડિંગ યુનિટના ક્ષેત્રફળ અનુસાર મળવાપાત્ર છે ? (ક) સુચિત વપરાશ રસ્તાની પહોળાઈ અનુસાર મળવાપાત્ર છે?						
(૫) કોમન પ્લોટ	<table border="1"> <tr> <td>નિયમ મુજબના કોમન પ્લોટનું ક્ષેત્રફળ</td> <td>સુચિત કરેલ કોમન પ્લોટનું ક્ષેત્રફળ</td> </tr> <tr> <td> </td><td> </td></tr> </table>	નિયમ મુજબના કોમન પ્લોટનું ક્ષેત્રફળ	સુચિત કરેલ કોમન પ્લોટનું ક્ષેત્રફળ			
નિયમ મુજબના કોમન પ્લોટનું ક્ષેત્રફળ	સુચિત કરેલ કોમન પ્લોટનું ક્ષેત્રફળ					
(૬) ગ્રાઉન્ડ ફ્લોર	<table border="1"> <tr> <td>નિયમ મુજબના ગ્રા.ફ્લોરનું ક્ષેત્રફળ</td> <td>સુચિત કરેલ ગ્રા.ફ્લોરનું ક્ષેત્રફળ</td> </tr> <tr> <td> </td><td> </td></tr> </table>	નિયમ મુજબના ગ્રા.ફ્લોરનું ક્ષેત્રફળ	સુચિત કરેલ ગ્રા.ફ્લોરનું ક્ષેત્રફળ			
નિયમ મુજબના ગ્રા.ફ્લોરનું ક્ષેત્રફળ	સુચિત કરેલ ગ્રા.ફ્લોરનું ક્ષેત્રફળ					
(૭) એફ.એસ.આઈ.	<table border="1"> <tr> <td>નિયમ મુજબ મળવાપાત્ર એફ.એસ.આઈ.</td> <td>સુચિત કરેલ એફ.એસ.આઈ.</td> </tr> <tr> <td> </td><td> </td></tr> </table> <p>પેમેન્ટ એફ.એસ.આઈ.</p>	નિયમ મુજબ મળવાપાત્ર એફ.એસ.આઈ.	સુચિત કરેલ એફ.એસ.આઈ.			
નિયમ મુજબ મળવાપાત્ર એફ.એસ.આઈ.	સુચિત કરેલ એફ.એસ.આઈ.					
	<table border="1"> <tr> <td>નિયમ મુજબ મળવાપાત્ર પેમેન્ટ એફ.એસ.આઈ.</td> <td>સુચિત કરેલ પેમેન્ટ એફ.એસ.આઈ.</td> </tr> <tr> <td> </td><td> </td></tr> </table>	નિયમ મુજબ મળવાપાત્ર પેમેન્ટ એફ.એસ.આઈ.	સુચિત કરેલ પેમેન્ટ એફ.એસ.આઈ.			
નિયમ મુજબ મળવાપાત્ર પેમેન્ટ એફ.એસ.આઈ.	સુચિત કરેલ પેમેન્ટ એફ.એસ.આઈ.					
(૮) ૧. માર્જિન	<table border="1"> <tr> <td>નિયમ મુજબ રસ્તાથી જરૂરી માર્જિન</td> <td>સુચિત કરેલ માર્જિન</td> </tr> <tr> <td> </td><td> </td></tr> </table>	નિયમ મુજબ રસ્તાથી જરૂરી માર્જિન	સુચિત કરેલ માર્જિન			
નિયમ મુજબ રસ્તાથી જરૂરી માર્જિન	સુચિત કરેલ માર્જિન					
	<table border="1"> <tr> <td>નિયમ મુજબ રસ્તા સિવાયની બાજુઓ જરૂરી માર્જિન</td> <td>સુચિત કરેલ માર્જિન</td> </tr> <tr> <td> </td><td> </td></tr> </table>	નિયમ મુજબ રસ્તા સિવાયની બાજુઓ જરૂરી માર્જિન	સુચિત કરેલ માર્જિન			
નિયમ મુજબ રસ્તા સિવાયની બાજુઓ જરૂરી માર્જિન	સુચિત કરેલ માર્જિન					

૨. વર્ગીકૃત રસ્તાથી બિલ્ડિંગ કંટ્રોલ લાઈન ..... મી. દર્શાવેલ છે? જે નિયમ મુજબ છે? ...						
૩. કોમન પ્લોટથી રાખેલ માર્જન ... મી. દર્શાવેલ છે. જે નિયમ મુજબ છે? ..						
૪. બે બિલ્ડિંગ વચ્ચે રાખવાપાત્ર માર્જન ... મી. દર્શાવેલ છે. જે નિયમ મુજબ છે? ? .....						
(૫) પાર્કિંગ લે આઉટ રજુ કરેલ છે? ..... (રહેણાંક / વાણીજ્ય / અન્ય)						
<table border="1" style="width: 100%; border-collapse: collapse;"> <tr> <td style="padding: 5px;">નિયમ મુજબ રાખવાપાત્ર પાર્કિંગ</td> <td style="padding: 5px;">સુચવેલ પાર્કિંગ</td> </tr> <tr> <td style="height: 40px;"></td> <td style="height: 40px;"></td> </tr> </table>	નિયમ મુજબ રાખવાપાત્ર પાર્કિંગ	સુચવેલ પાર્કિંગ				
નિયમ મુજબ રાખવાપાત્ર પાર્કિંગ	સુચવેલ પાર્કિંગ					
(૧૦) સુચિત મકાનની લંબાઈ + માર્જન + રોડ + સી.પી. ની લંબાઈ / પહોળાઈનો સરવાળો બીલ્ડિંગ યુનીટના માપ સાથે સુસંગત છે						
(૧૧) (અ) આંતરીક રસ્તા						
<table border="1" style="width: 100%; border-collapse: collapse;"> <tr> <td style="padding: 5px;">નિયમ મુજબ રાખવાપાત્ર આંતરીક રસ્તાની પહોળાઈ</td> <td style="padding: 5px;">સુચવેલ આંતરીક રસ્તા</td> </tr> <tr> <td style="height: 40px;"></td> <td style="height: 40px;"></td> </tr> </table>	નિયમ મુજબ રાખવાપાત્ર આંતરીક રસ્તાની પહોળાઈ	સુચવેલ આંતરીક રસ્તા				
નિયમ મુજબ રાખવાપાત્ર આંતરીક રસ્તાની પહોળાઈ	સુચવેલ આંતરીક રસ્તા					
(૭) આંતરીક રસ્તાના જંક્શન ઉપર નિયમ મુજબ ગોળાઈ દર્શાવેલ છે? .....						
(૧૨) ગંદા પાણીના નિકાલ અંગેની વ્યવસ્થા આઇ.એસ.૨૪૭૦ નિયમ અનુસાર દર્શાવેલ છે? .....						
(૧૩) પરકોલેટીંગ વેલ						
<table border="1" style="width: 100%; border-collapse: collapse;"> <tr> <td style="padding: 5px;">નિયમ મુજબ જરૂરી પરકોલેટીંગ વેલ</td> <td style="padding: 5px;">સુચીત કરેલ પરકોલેટીંગ વેલ</td> </tr> <tr> <td style="height: 40px;"></td> <td style="height: 40px;"></td> </tr> </table>	નિયમ મુજબ જરૂરી પરકોલેટીંગ વેલ	સુચીત કરેલ પરકોલેટીંગ વેલ				
નિયમ મુજબ જરૂરી પરકોલેટીંગ વેલ	સુચીત કરેલ પરકોલેટીંગ વેલ					
(૧૪) સબપ્લોટના ક્ષેત્રફળમાંથી ગોળાઈ બાદ કરેલ છે?						
(૧૫) ઓરોયા ટેબલમાં દરેક સબપ્લોટ તથા આંતરીક રસ્તાનું ક્ષેત્રફળ તથા કોમન પ્લોટનું ક્ષેત્રફળ દર્શાવેલ છે? કુલ ક્ષેત્રફળની સામે સુસંગત થાય છે? .....						
(૧૬) કલર નોંધ નિયમ મુજબ દર્શાવેલ છે? .....						
(૧૭) વિશેષ નોંધ.						

[ III ] બિલ્ડિંગ પ્લાનની ચકાસણી :-

(૧) લે આઉટ પ્લાનમાં દર્શાવેલ દરેક ટાઇપના બીલ્ડિંગના નકશાઓ રજુ કરેલ છે?		
--	--	--

(૨) એલીવેશન તથા સેક્શનમાં માપ દર્શાવેલ છે ?

(૩) પ્લીન્થની ઉંચાઈ ..... મી. (લઘુતમ ૦.૪૫ મી.), ફ્લોરની ઉંચાઈ ..... મી. (લઘુતમ ૨.૮૦ મી., હોલોપ્લીન્થની ઉંચાઈ ..... મી. (મહતમ ૨.૮ મી.) દર્શાવેલ છે. જે નિયમ મુજબ છે ?

(૪) બિલ્ડિંગની ઉંચાઈ

લો-રાઇઝ બિલ્ડિંગની નિયમ મુજબ ઉંચાઈ	લો-રાઇઝ બિલ્ડિંગની સુચીત કરેલ ઉંચાઈ
R-I -	R-I -
R-II -	R-II -
R-III-	R-III-
અન્ય ઝોન માટે	અન્ય ઝોન માટે

(૫) સેક્શન લાઇન સ્પેશ્ટ રીતે દર્શાવી સીડી માંથી સેક્શનના નકશો દર્શાવેલો છે ?

(૬) રૂમોના માપ (લઘુતમ ૨.૪ મી.) ઉપયોગ, લઘુતમ ક્ષેત્રફળ (લઘુતમ ૮.૦ ચો.મી.), વેન્ટીલેશન દર્શાવેલ છે જે નિયમ મુજબ છે?

(૭) રૂમોના માપ + ડિવાલની જાડાઈનો સરવાળો બીલ્ડિંગની કુલ લંબાઈ / પણોળાઈ સાથે સુસંગત છે ?

(૮) રૂમોમાં દર્શાવેલ લોફ્ટ નિયમ મુજબ છે ?

ભોયંડુ દર્શાવેલ હોય તો?

(૯) ભોયરાની ઉંચાઈ

ભોયરાની નિયમ મુજબ મળવાપાત્ર ઉંચાઈ	ભોયરાની સુચીત ઉંચાઈ

(૧૦) ભોયરામાં વેન્ટીલેશન નિયમ મુજબ છે ?

(૧૧) ભોયરામાં \_\_\_\_\_ ઉપયોગ દર્શાવેલ છે જે નિયમ મુજબ છે ?

(૧૨) ભોયરામાં જવાની સીડી નિયમ મુજબ છે ?

ભોયરામાં જવાની સીડી નિયમ મુજબ મળવાપાત્ર	સુચીત સીડી

(૧૩) જો ભોયરામાં પાર્કિંગ દર્શાવેલ હોય તો

જરૂરી રેમ્પની પહોળાઈ \_\_\_\_\_ મી. છે. જે નિયમ મુજબ છે ?

(૧૪) સીડીની પહોળાઈ \_\_\_\_\_ મી. છે જે નિયમ મુજબ છે ?

- એક ફ્લાઇટમાં ૧૨ પગથીયાથી ઓછા દર્શાવેલ છે કે કેમ ?

- ઉપયોગ પ્રમાણે ટ્રેડ નિયમ મુજબ છે ?

- ઉપયોગ પ્રમાણે રાઇઝર નિયમ મુજબ છે ?

(૧૫) સીડીની વિગતો નકશામાં દર્શાવેલ છે ?

(૧૬) પેસેજ / લોબી / કોરીડોર ની લંબાઈ મુજબ પહોળાઈ દર્શાવેલ છે ?

(૧૭) દરેક માળનો બીલ્ટ-અપ એફ.એસ.આઇ.ગાળતી સાથે દર્શાવેલ છે ? તે નિયમ મુજબ છે ?

(૧૮) દરેક વાસની સંખ્યા દર્શાવેલ છે ?

(૧૯) સેનેટરી સવલતો નિયમ મુજબ ગાળતરી સહિત દર્શાવેલ છે ?

(૨૦) આંતરીક અને બાહ્ય ઓપન એર સ્પેસ નિયમ મુજબ મુકેલા છે ?

(૨૧) મકાનની લંબાઈ બાબતેના નિયમ મુજબ જોગવાઈ કરેલ છે ?

(૨૨) લીફ્ટની સંખ્યા અને માપ નિયમ મુજબ છે ?

નિયમ મુજબ રાખવાની થતી લીફ્ટ	સુચીત લીફ્ટની સંખ્યા

[ IV ] બહુમાળી મકાન બાંધકામ માટેના વધારાના ચકાસણી ના મુદ્રા

- (૧) ફાયર માટેની અંડર ગ્રાઉન્ડ વોટર ટેંક નિયમ મુજબ દર્શાવેલ છે ?
- (૨) ફાયર માટેની જરૂરી ક્ષમતાવાળી ઓવરહેડ વોટર ટેંક નિયમ મુજબ દર્શાવેલ છે ?
- (૩) ફાયરના લેઆઉટ પ્લાનમાં નિયમ મુજબ વિગતો દર્શાવેલ છે ?
- (૪) ચીફ ફાયર ઓફિસર, અ.સ્પુ.કો.નો અભિપ્રાય મેળવેલ છે ?
- (૫) બીટીંગની ઉંચાઈ નિયમ મુજબ છે ?

નિયમ મુજબ મળવાપાત્ર ઉંચાઈ	સુચીત ઉંચાઈ

- (૬) રેફયુઝ એરીયા નિયમાનુસાર દર્શાવેલ છે ?

નિયમ મુજબ મળવાપાત્ર એરીયા	સૂચીથ એરીયા

- (૭) વિશેષ નોંધ

વિશેષ કારણોસર માંગવામાં આવતી છુટછાટની વિગતો :-

હું શ્રી \_\_\_\_\_ સત્તામંડળનો રજી.આર્કી/એન્જી છું. અને  
 \_\_\_\_\_ નંબર અને \_\_\_\_\_ તારીખથી અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળનું રજીસ્ટ્રેશન ધરાવું છું.  
 આથી હું જણાવું છું કે ઉપરોક્ત ફોર્મમાં જણાવેલ તમામ વિગતો મારી જાણ મુજબ સંપૂર્ણ સચોટ અને ખરી છે. તે બાબતે  
 આથી ખાત્રી સાથે કબુલ કરું છું. અને સત્તામંડળના બધા નિયમો, વિનિયમો, વખતોવખતના હુકમો – સુચનોનું પાલન  
 કરવા બંધાવું છું. અને વિનિયમોમાં જણાવેલ મારી જવાબદારીઓ અને ફરજો અદા કરીશ તેની પાકી ખાત્રી આપું છું.

હું સમજું છું કે જો આ ફોર્મમાં જણાવેલ માહિતી ખોટી અથવા ગેરમાર્ગ દોરનારી કે બદદરાદાવાળી પુરવાર  
 થશે અથવા હું મારી ફરજો નિભાવવામાં ચુક કરીશ તો અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ મારું રજીસ્ટ્રેશન રદ કરી  
 શકશે તથા મારી ડિપોર્ઝિટ જ્યાં કરી શકશે તથા મારી સામે ફોજદારી પગલા લઈ શકશે.

તારીખ : \_\_\_\_\_

આર્કીટેક્ટ / એન્જિનિયરનો સિક્કો / સહી

રજીસ્ટ્રેશન નંબર \_\_\_\_\_ તા. \_\_\_\_\_

આથી હું સત્તામંડળનો રજી. આર્કી/એન્જીશ્રી \_\_\_\_\_ પ્રમાણીત કરું છું કે ખાનમાં દર્શાવેલ  
 સંબધીત ખોટનો મેં સર્વ તા. \_\_\_\_\_ ના રોજ કરેલ છે. તથા સંબધિત જમીનની હંદો અને માપો ખાનમાં  
 દર્શાવેલ છે. જે સ્થળ પર ચકાસી ખાત્રી કરી ક્ષેત્રફળની પણ ચકાસણી કરી ટી.પી.સ્કીમના ટી.પી રેકર્ડવાળા  
 ડોક્યુમેન્ટ્સ/ડી.પી અન્વયે ૭/૧૨ તથા ટીપ્પણ પ્રમાણે સુચવેલ છે. તથા સંબધિત સ.ન.નું એન્લાર્જમેન્ટ નિયત સ્કેલમાં  
 રજુ કરી તેને થતી ડી.પી/ ટી.પી/ બ્રોડ લે-આઉટની અસરો દર્શાવેલ છે. જે બરાબર છે

તારીખ : \_\_\_\_\_

આર્કીટેક્ટ / એન્જિનિયરનો સિક્કો / સહી

રજીસ્ટ્રેશન નંબર \_\_\_\_\_ તા. \_\_\_\_\_

હું શ્રી \_\_\_\_\_ ઉપર જણાવેલ જમીન/ ખોટના જમીનમાલિક/  
 કષેત્રદાર/દેવલપર્સ તરીકે જણાવું છું કે આર્કી/એન્જી.શ્રી \_\_\_\_\_ સત્તામંડળમાં  
 રજીસ્ટ્રેશન ધરાવે છે અને તેઓની મારી જમીનના વિકાસ માટે આર્કી/એન્જી.તરીકે નિમણૂંક કરેલ છે. હું ખાત્રી આપું છું  
 કે મારા નિમણૂંક કરેલ આર્કી/એન્જી.શ્રી જી.ડી.સી.આર તથા ગુણવત્તા બાબતે જે કાંઈ સુચના આપશે તેનું હું પાલન  
 કરવા બંધાયેલો છું. વધુમાં પાકી ખાત્રી આપું છું કે N.B.C અને તેને આનુસંધિક I.S. માં જણાવેલ બીલ્ડિંગના  
 બાંધકામ તથા તેમાં લગતાં તમામ મટીરીયલ્સ નો ઉપયોગ તેમના જણાવ્યા પ્રમાણે કરીશ.

તારીખ \_\_\_\_\_

જમીનમાલિક / કષેત્રદાર / દેવલપર નું નામ : \_\_\_\_\_

સરનામું : \_\_\_\_\_

સહી :

## ફીની ગણતરી

- (૧) માપણીશીટ/ડી.પી./ટી.પી.પાર્ટ ખાન/ ઝોનીંગ = \_\_\_\_\_
- (૨) ચકાસણી ફી. (લઘુતમ ૩૦૦.૦૦/- રૂ.) = \_\_\_\_\_
- (i) વાણીજ્ય/હાઇરાઇઝ/રહેણાંક સીવાય/મિક્સ બાંધકામ \_\_\_\_\_ x ૫.૦૦ રૂ. / ચો.મી = \_\_\_\_\_
  - (ii) રહેણાંક (લો-રાઇઝ બિલ્ડિંગ માટે).. \_\_\_\_\_ x ૩.૦૦ રૂ. / ચો.મી = \_\_\_\_\_
  - (iii) પદ્ધલીક ચેરીટેબલ ટ્રેસ્ટ ..... = ૫૦૦.૦૦રૂ.
- (૩) ઓક્નીકરણ / ભાગલાની ફી. (લઘુતમ ૩૦૦.૦૦/- રૂ.) = \_\_\_\_\_
- ખેતી વિષયક સીવાયના/ખાસ ખેતી વિષયક વિસ્તાર સિવાયના \_\_\_\_\_ x ૧.૫૦ રૂ. / ચો.મી = \_\_\_\_\_
- વિસ્તારમા
- ખેતી વિષયક ઝોન/ ખાસ ખેતી વિષયક વિસ્તાર માં.... \_\_\_\_\_ x ૦.૫૦ રૂ. / ચો.મી = \_\_\_\_\_
- (૪) શહેરી કરણ વિસ્તાર સિવાય ખેતીવિષયક ઝોનમાં તથા કલોલ-દહેગામ-મહેમદાવાદ-સાંશાદ-બારેજડી-નાંદેજમાં આવતા વિસ્તાર માટે ઉપરના અનુક્રમ નં.(૨) અને (૩) ની ૫૦% ફી
- (૫) બેટરમેન્ટ ચાર્જ / ડીપોઝિટ = \_\_\_\_\_
- (૬) ટ્રી પ્લાન્ટેશન ચાર્જ = \_\_\_\_\_
- (i) ૮૦ ચો.મી થી નાના યુનિટ \_\_\_\_\_ નં x ૧૨૫.૦૦ રૂ. / યુનિટ = \_\_\_\_\_
  - (ii) ૮૦ ચો.મી થી મોટા યુનિટ \_\_\_\_\_ નં x ૫૦૦.૦૦ રૂ. / યુનિટ = \_\_\_\_\_
  - (iii) સ્વતંત્ર બંગલા / સબપ્લોટ \_\_\_\_\_ નં x ૨૫૦૦.૦૦ રૂ. / યુનિટ = \_\_\_\_\_
- (૭) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ચાર્જ \_\_\_\_\_ નં x ૧૦૦.૦૦ રૂ. / યુનિટ = \_\_\_\_\_
- (૮) એમીનીટોઝ ફી = \_\_\_\_\_
- (i) સ્કુલ / કોલેજ/એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યુટ/ સાર્વજનીક ટ્રેસ્ટ/ ગર્વમેન્ટ/ સેમી ગર્વ \_\_\_\_\_ x ૫૦.૦૦ રૂ. / ચો.મી = \_\_\_\_\_  
સંસ્થા માટે
  - (ii) ઉપરોક્ત સિવાયના અન્ય ઉપયોગ સારુ \_\_\_\_\_ x ૧૦૦.૦૦ રૂ. / ચો.મી.= \_\_\_\_\_

(૮) ડેવલપમેન્ટ ચાર્જ

= \_\_\_\_\_

જમીન માટે :

અ.નં.	ઉપયોગ	શહેરીકરણ વિસ્તારમાં કોર્પો વિસ્તારની બહાર દર ચો.મી	સત્તામંડળના શહેરી કરણ સિવાયના કોઈપણ વિસ્તારમાં દર.ચો.મી	ગ્રોથ સેન્ટર
૧	રહેઠાણ	૧.૫૦	૧.૦૦	૧.૦૦
૨	વાણિજ્ય	૩.૦૦	૨.૦૦	૨.૦૦
૩	ઔદ્યોગિક	૩.૦૦	૨.૦૦	૨.૦૦
૪	પ્રક્રિયા	૧.૦૦	૦.૨૫	૦.૫૦

બાંધકામ માટે :-

અ.નં.	ઉપયોગ	શહેરીકરણ વિસ્તારમાં કોર્પો વિસ્તારની બહાર દર ચો.મી	સત્તામંડળના શહેરી કરણ સિવાયના કોઈપણ વિસ્તારમાં દર.ચો.મી	ગ્રોથ સેન્ટર
૧	રહેઠાણ	૩.૦૦	૨.૦૦	૨.૦૦
૨	વાણિજ્ય	૬.૦૦	૪.૦૦	૪.૦૦
૩	ઔદ્યોગિક	૬.૦૦	૪.૦૦	૪.૦૦
૪	પ્રક્રિયા	૨.૦૦	૦.૫૦	૧.૦૦

ઉપર મુજબના ટેબલ પ્રમાણે

જમીનનું ક્ષેત્રફળ \_\_\_\_\_ ચો.મી. x દર \_\_\_\_\_ રૂ. = \_\_\_\_\_ રૂ.

બાંધકામનું ક્ષેત્રફળ \_\_\_\_\_ ચો.મી. x દર \_\_\_\_\_ રૂ. = \_\_\_\_\_ રૂ.

(૧૦) યુ.એ.ડી.ફી.

અ.નં.	યુ.એ.ડી.ફી	જ.ડી.સી.આરના રેગ્યુ નં.૫.૬
૧	વિકાસ પરવાનગી માટે અરજી કરેલ હોઇ અને રજુ કરેલ નકશા પ્રમાણે વિકાસ કામ શરૂ કરેલ હોય	ચકાસણી ફીના પાંચ ગણા
૨	વિકાસ પરવાનગી માટે અરજી કરેલ હોઇ પરંતુ રજુ કરેલ નકશા પ્રમાણે વિકાસ શરૂ કરેલ ન હોઇ	ચકાસણી ફીના દસ ગણા
૩	વિકાસ પરવાનગી માટે અરજી કરેલ ન હોઇ અને વિકાસ કામ શરૂ કરેલ હોય	ચકાસણી ફીના પંદર ગણા
૪	બીજા બધા ખુલ્લા ઉપયોગ અને	ચકાસણી ફીના બે ગણા

ઉપર મુજબના ટેબલ પ્રમાણે

$$\text{ક્ષેત્રફળ} \quad \text{ચો.મી.} \times ૬૨ = \text{રૂ.} =$$

(૧૧) ડેનેજ ચાર્ટ્સ

## (A) રહેણાંક

$$(i) ૨૫.૦૦ \text{ ચો.મી. સુધી } \quad \text{_____} \times ૮૦૦.૦૦ \text{ રૂ.}/\text{યુનિટ} = \text{_____}$$

$$(ii) ૨૬.૦૦ \text{ ચો.મી. થી } ૪૦.૦૦ \text{ ચો.મી. ના યુનિટ માટે } \quad \text{_____} \times ૧૫૦૦.૦૦ \text{ રૂ.}/\text{યુનિટ} = \text{_____}$$

$$(iii) ૪૧.૦૦ \text{ ચો.મી. થી } ૮૦.૦૦ \text{ ચો.મી.ના યુનિટ માટે } \quad \text{_____} \times ૨૦૦૦.૦૦ \text{ રૂ.}/\text{યુનિટ} = \text{_____}$$

$$(iv) ૮૧.૦૦ \text{ ચો.મી. થી } ૧૫૦.૦૦ \text{ ચો.મી.ના યુનિટ માટે } \quad \text{_____} \times ૩૦૦૦.૦૦ \text{ રૂ.}/\text{યુનિટ} = \text{_____}$$

$$(v) ૧૫૦.૦૦ \text{ ચો.મી. થી મોટા યુનિટ } \quad \text{_____} \times ૪૦૦૦.૦૦ \text{ રૂ.}/\text{યુનિટ} = \text{_____}$$

## (B) વાણિજ્ય :

$$(i) ૧૦૦ \text{ ચો.મી સુધી } \quad ૩૫૦૦.૦૦ \text{ રૂ.} = \text{_____}$$

$$(ii) ૧૦૧ થી ૨૦૦ ચો.મી સુધી } \quad ૬૦૦૦.૦૦ \text{ રૂ.} = \text{_____}$$

$$(iii) ૨૦૧ થી ૩૦૦ ચો.મી સુધી } \quad ૮૦૦૦.૦૦ \text{ રૂ.} = \text{_____}$$

$$(iv) ૩૦૦ ચો.મી. થી વધુ હોય તો દર ૧૦૦ ચો.મી. દીઠ ૩૦૦૦.૦૦ \text{ રૂ.} = \text{_____}$$

(૧૨) લેમીનેશન ચાર્જ } \times ૨૦ \text{ રૂ.}/\text{ચો.કુટ } = \text{\_\_\_\_\_}

(૧૩) કલમ ૨૩ (i) (vi-a) મુજબની સર્વીસીસ ડીપોર્ટેટ

વાણીજ્ય સિવાય											
Area-1			Area-2			Area-3			Area-4		
X	Y	Z	X	Y	Z	X	Y	Z	X	Y	Z
30	20	10	15	10	5	0	5	5	5	5	5

વાણીજ્ય												
ફ્લોર	Area-1			Area-2			Area-3			Area-4		
	X	Y	Z	X	Y	Z	X	Y	Z	X	Y	Z
G.F.	800	600	450	600	450	300	450	300	200	300	200	100
F.F.	400	300	---	300	200	---	200	150	---	150	100	---
G.F. + F.F. સિવાય	100	---	---	50	---	---	30	---	---	15	---	---

રજીસ્ટર્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા વાણીજ્ય સિવાયનાં ઉપયોગ માટે											
Area-1			Area-2			Area-3			Area-4		
X	Y	Z	X	Y	Z	X	Y	Z	X	Y	Z
10	5	5	10	5	5	10	5	5	10	5	5

ઉપર દર્શાવ્યા મુજબ ફી ની વસુલાત તાત્કાલીક અસરથી કરવાની રહેશે.

X ૧૮.૦ મી. અને તેથી મોટા રસ્તા ઉપર

Y ૧૨.૦ મી. અને તેથી મોટા રસ્તા ઉપર અને ૧૮.૦ મી. થી નાના રસ્તા ઉપર

Z ૧૨.૦ મી. થી નાના રસ્તા ઉપર

નોંધ :

- (૧) (એરીયા-૧) ઝોન-૧ – નગર રચના યોજના નં. વેજલપુર-૪ થી ૬, વસ્ત્રાપુર-૧, મેમનગર-૧, થલતેજ-૧, ૨, બોડકદેવ-૧/અ, ૧/બ, ઘાટલોડીયા-૧, ૨.
- (૨) એરીયા-૨ (ઝોન-૨) – નગર રચના યોજના નં. થલતેજ-૩૭, ૩૮, બોડકદેવ-૫૦, ૫૧, વેજલપુર-૨૩, ૨૪, ૨૫, ૨૭, મકરબા-૨૬, વેજલપુર-૧ થી ૩, ચાંદલોડીયા-૧, રાણીપ-૧, ૨, ૩, મકરબા ગામનો રહેણાંક ઝોન-૧ હેઠળનો વિસ્તાર તથા ગામ નરોડાનો વિસ્તાર.
- (૩) એરીયા-૩ (ઝોન-૩)
- (અ) ટી.પી.સ્કીમ નં. ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૪૧, ૪૨, ૪૩, મકરબા-૮૩, ૮૨, મોટેરા, ચાંદખેડાનો આર-૧, આર-૨ નો વિસ્તાર, સરખેજ-ગાંધીનગર હાઇવેથી પશ્ચિમ તરફનો આંબલી, થલતેજ, ભાડજ, હેબતપુર, સોલા, ઓગણજ, ગોતા, બોડકદેવ, જગતપુર, છારોડી, ખોડીયારનો રહેણાંક-૨ નો વિસ્તાર.
- (બ) પૂર્વ તરફનો વિકાસ નકશાની દરખાસ્તનો રહેણાંક ઝોન અને ઔદ્ઘોગીક ઝોનમાં આવરી લેવાયેલ સમગ્ર ગામ નરોડા વિસ્તાર સિવાયનો વિસ્તાર.
- (ક) ખેતી ઝોનમાં આવતા વિસ્તારનાં ગામતળનાં કુદરતી વિકાસ માટેનો વિસ્તાર.
- (૪) એરીયા-૪ (ઝોન-૪) - ઉપરોક્ત ઝોન ૧ થી ૩ માં સમાવેશ થતો નથી તેવો વિકાસ નકશાનો સમગ્ર વિસ્તાર તેમજ કલોલ, સાણંદ, દહેગામ, મહેમદાવાદ વિગેરે પરંતુ ખેતીઝોન સિવાયનો વિસ્તાર તથા રહેણાંક ઝોન-૩ હેઠળનો સમગ્ર વિસ્તાર.
- પરંતુ ખેતીઝોન વિસ્તારમાં સંપૂર્ણપણે વાણીજ્ય વિકાસ થતો વિસ્તાર માટે એરીયા-૪ મુજબ વાણીજ્યનાં દર લાગુ પડશે.

ઉપર પ્રમાણે બાંધકામના કુલ ક્ષેત્રફળ \_\_\_\_\_ ચો.મી. x ૬૨ \_\_\_\_\_ = રૂ. \_\_\_\_\_

વિકાસ પરવાનગીની અરજીનાં પ્રાથમીક ચકાસણી ફોર્મેમાં એન્જનીયરશ્રી / આર્કિટેક્ટશ્રી ધ્વારા ૨જુ  
કરાયેલ વિગતો ચકાસણી કરતાં યોગ્ય જણાય છે.

- ખા.આસી.શ્રીની સહી.